

ત્વરિત જાહેરાત માટે

## સિટી ઓફ બ્રમ્પટન યોજે છે પહેલ વહેલો યુવા દિન (યુથ ડે), જેમાં યુવાધનને ટેકો આપવા તથા તેમના સશક્તિકરણ માટે ઓનલાઇન ઇવેન્ટ હશે

બ્રમ્પટન, ઓન્ટારિયો (21 ઓગસ્ટ 2020) – ગુરૂવાર, સપ્ટેમ્બર 3ના રોજ બપોરે 12 થી 3 વાગ્યા સુધી સિટી ઓફ બ્રમ્પટનનો COVID-19 યુથ સપોર્ટ ટાસ્ક ફોર્સ રજૂ કરે છે યુવા દિન (યુથ ડે)! અમારી સાથે ઘણાં બધાં વક્તાઓની રોમાંચક વાતો અને ઓનલાઇન સ્ટ્રીમ કરવામાં આવનાર સવાલજવાબ સત્રમાં જોડાવ.

સિટી ટીવીનાં ક્રિસ્ટિના હોવોર્નની જે રજૂઆત છે તે યુથ ડે એવી વર્ચુઅલ જગ્યા છે જ્યાં યુવા લોકોને આશા જગાડતી, સામનો કરવાની રીતો શીખવતી તેમજ 2020માં પ્રેરિત થતા રહેવાની વાતો સાંભળવા મળશે. મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown), સિટી કાઉન્સિલર શેરમેન વિલિયમ્સ (Charmaine Williams) અને સિટી કાઉન્સિલર હરકિરત સિંઘના વક્તવ્યો સાંભળી શકાશે તેમજ નીચે આપેલ પાંચ વિશિષ્ટ વિષયો પર પાંચ વિશેષજ્ઞ વક્તાઓના ઉદ્બોધનો સાંભળી શકાશે.

- BELL રજૂ કરે છે મેન્ટલ હેલ્થ (Mental Health) - વિશેષજ્ઞ યોનાહ બડ પાસેથી વ્યગ્રતા પર કાબૂ મેળવવા પ્લાન બી જાણવા મળશે
- વન વોઈસ વન ટીમ યુથ લિડરશીપ ઓર્ગનાઈઝેશનના સંસ્થાપક ઓર્લાન્ડો બોવન વંશવાદ-વિરોધ વિશે બોલશે
- LGBTQ+ સમાનતા પર બોલશે જાણીતા હોસ્ટ, લેખક અને નિર્માતા ડેનિયલ પિલ્વાઈ
- ફેશન ગુરૂ ડ સેન્ડી લાયન (The Sandy Lion) પ્રભાવકો સાથેની પારદર્શિતા વિશે બોલશે
- પ્રેરણાદાયક વક્તા એન્યની મક્લીન બોલશે વૈવિધ્ય અને સમાવેશિતાથી હેરાનગતી પર

પ્રવૃત્ત કરતા ખુલ્લા સવાલજવાબથી બપોરનું સત્ર સમાપ્ત થશે જેમાં તમામ વક્તાઓ ભાગ લેશે.

બ્રમ્પટન યુથ ડેનું ગૌરવપૂર્ણ પ્રાયોજન થયું છે BELL, CN, RBC અને EB Games દ્વારા.

હાજર રહેવા માટે રજિસ્ટ્રેશન જરૂરી છે. કૃપા કરીને અહીં ઇમેલ કરો [events@brampton.ca](mailto:events@brampton.ca) જેથી હાજરીની પુષ્ટિ કરી શકાય અને ઇવેન્ટમાં જોડાવા માટેલોગિન માહિતી મેળવી શકાય. સંપૂર્ણ ઇવેન્ટ અને વક્તાઓની વિગતો માટે અહીં મુલાકાત લો [brampton.ca/bramptonyouthday](http://brampton.ca/bramptonyouthday) .

### COVID-19 યુથ સપોર્ટ ટાસ્ક ફોર્સ

સિટી ઓફ બ્રમ્પટન COVID-19 યુથ સપોર્ટ ટાસ્ક ફોર્સની આગેવાની સિટી કાઉન્સિલર શેરમેન વિલિયમ્સ (Charmaine Williams) અને સિટી કાઉન્સિલર હરકિરત સિંઘ (Harkirat Singh) સાથે મળીને કરશે. સંસાધનો અને ટેકો પૂરો પાડીને, 40 થી વધુ યુવા-સેવા આપતી

સ્થાનિક સંસ્થાઓ સાથે જોડાણ કરીને, યુવાનોને ઘરે ઓનલાઇન પ્રવૃત્તિ રાખીને ટાસ્ક ફોર્સ COVID-19 રોગચાળા દરમિયાન 14 થી 29 ની વયના બ્રમ્પટનનાં યુવાનોની જરૂરિયાતો પૂર્ણ કરશે. વધુ માહિતી માટે [અહીં ક્લિક કરો](#) .

### યુથ ફ્રેન્ડલી કમ્યુનિટી ડેઝિગ્નેશન (Youth Friendly Community Designation)

આ વર્ષે, પ્લે વર્ક્સ (Play Works) દ્વારા સિટી ઓફ બ્રમ્પટનને પ્લેટિનમ સ્ટેટસ યુથ ફ્રેન્ડલી કમ્યુનિટી ડેઝિગ્નેશન પ્રાપ્ત થયું જે પાર્ક્સ એન્ડ રિક્રિએશન ઓન્ટારિયો દ્વારા સહાય મેળવતો કાર્યક્રમ છે. સિટીને ત્રીજી વખત તેમની યુવા વિકાસની તકો તરફની ઉત્કૃષ્ટ પ્રતિબદ્ધતા માટે પુરસ્કૃત કરવામાં આવેલ છે અને ટોચનું પ્લેટિનમ ડેઝિગ્નેશન મેળવનારા ત્રણ સમુદાયો પૈકી એક બન્યું છે. વધુ જાણવા માટે [અહીં ક્લિક કરો](#) .

### અવતરણો

"યુવાઓ માટેની તકોના આગેવાન તરીકે, ફરી એક વખત બ્રમ્પટન આપણા સમાજના યુવાન લોકો માટેનો સહુ પ્રથમ યુવા દિન માટે માર્ગ મોકળો કરી રહ્યા છે. COVID-19 રોગચાળા દરમિયાન બ્રમ્પટનના યુવાનોના વિકાસમાં મદદરૂપ થવા અને અર્થપૂર્ણ રીતે પ્રવૃત્તિ કરવા માટે COVID-19 યુથ સપોર્ટ ટાસ્ક ફોર્સનું સર્જન કરવામાં આવ્યું હતું. આ ઓનલાઇન ઈવેન્ટ આ પ્રતિબદ્ધતાના સીધા પરિણામરૂપે થાય છે અને હું બધાને આ પ્રેરણાદાયક કાર્યક્રમમાં બપોરે હાજર રહેવા પ્રોત્સાહિત કરું છું."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન

"અમારા ધ્યાનમાં છે કે 2020 નું વર્ષ બ્રમ્પટનના યુવાનો માટે પડકારરૂપ સમય રહ્યો છે. COVID-19 યુથ સપોર્ટ ટાસ્ક ફોર્સ દ્વારા તેમની સાથેની વાતચીતના પરિણામ રૂપે આ ઈવેન્ટ આપણા સમુદાયના જોરદાર યુવાધનને ટેકો આપવા અને સશક્તિકરણ કરવા માટે બનાવવામાં આવી હતી. આપણા સમાજને શું જોઈએ છે તે અમે જાણ્યું છે અને અમે તેને અંજામ આપી રહ્યા છીએ.

- શેરમેન વિલિયમ્સ, સીટી કાઉન્સિલર, વોર્ડ 7& 8, સહ પ્રમુખ, COVID-19 યુથ સપોર્ટ ટાસ્ક ફોર્સ, સીટી ઓફ બ્રમ્પટન

"બ્રમ્પટનના યુવાનો નીડર, મહત્વાકાંક્ષી અને પ્રેરણાદાયક છે અને અમે વિશિષ્ટ વિષયો પર બોલવા માટે નિબળાત વક્તાઓને આમંત્રિત કર્યા છે જેથી તેમના ઉજ્જવળ ભવિષ્યને મદદરૂપ થઈ શકાય અને આ ગતિને જાળવી શકાય. COVID-19 યુથ સપોર્ટ ટાસ્ક ફોર્સ બ્રમ્પટન ખાતેના યુવાનોને મદદરૂપ થવા સમર્પિત છે."

- હરકિરત સિંઘ, સીટી કાઉન્સિલર, વોર્ડ 9& 10, સહ પ્રમુખ, COVID-19 યુથ સપોર્ટ ટાસ્ક ફોર્સ, સીટી ઓફ બ્રમ્પટન

"સીટી ઓફ બ્રમ્પટનને યુવા દિનની રજૂઆત કરતા ગૌરવની લાગણી થાય છે જેમાં આજના યુવાન માટે મહત્વ અને સંબંધ ધરાવતા વિષયો રજૂ કરવા માટે રસપ્રદ વક્તાઓની હરોળ છે. કાઉન્સિલ અને સિટીના કર્મચારીગણના સમર્પણથી આ ઈવેન્ટનું આયોજન શક્ય બન્યું છે અને તમારે તેમાં ભાગ લેવો જ જોઈએ."

- ડેવિડ બાર્રિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સિટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે [www.brampton.ca](http://www.brampton.ca).

#### મિડિયા સંપર્ક

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)